

# Cooperation among select countries of the Indo-Pacific in fighting COVID-19 pandemic

May 14, 2020

કોવિડ-19 મહામારી સામેની લડાઈમાં ઈન્ડો-પેસિફિકનાં યુનંદા દેશો વચ્ચે સહકાર મે 14, 2020

વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલા યુનાઈટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, જાપાન, કોરીયા ગણરાજ્ય, ન્યૂઝીલેન્ડ અને વિયેતનામનાં સમક્ષો સાથે કોવિડ-19 મહામારીએ પ્રસ્તૂત કરેલા અનન્ય અને જટિલ પડકારો સામે પ્રતિભાવ આપવા માટે ઈન્ડો-પેસિફિક પ્રાંતમાં આ દેશો વચ્ચે વિચારો અને શ્રેષ્ઠ પ્રયાઓનું આદાન-પ્રદાન કરવા માટે 20 માર્ચ, 2020 અને 15 મે, 2020 વચ્ચે સાપ્તાહિક ધોરણે ટેલીફોન પર વાતચીતો કરવામાં સંકળાયેલા રહ્યા છે. આ સાપ્તાહિક વાતચીત કરવાની પ્રથાની યુ.એસ. ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ સ્ટીફન બીએગુન દ્વારા પહેલ કરવામાં આવી હતી.

સાથીદાર દેશો વચ્ચેની આ ચર્ચાઓએ એકબીજાનાં પ્રદેશોમાંથી ફસાયેલા નાગરિકોનું વિરેચન કરવા; જીવન બચાવતી દવાઓ અને રક્ષણાત્મક આરોગ્ય સાધનોનાં આવશ્યક પૂરવઠાઓની જાળવણી; પોતાનાં નિયંત્રણ બહારનાં સંજોગોમાં સપડાયેલા એકબીજાનાં નાગરિકો માટે વીઝાનું વિસ્તરણ અને સુવિધા; મહામારીથી અસરગ્રસ્ત થયેલી દેશોની ઓળખ કરવા અને સહાયતા કરવા અને નજીકનાં પાડોશીઓમાં સંકલિત પ્રતિભાવ અને સહાયતા; અને બહુઆયામી બાબતોમાં એકબીજા સાથે કામ કરવા સાથે EAS અને G20 સહિતનાં સૂચિત અને સંકલિત પ્રતિભાનોને આકાર આપવામાં મદદ કરી છે. કોવિડ-19 મહામારીનો પ્રતિકાર કરવા માટેનાં અને તેની અસરો નાબૂદ કરવાનાં કેટલાક વિચારોનું સાથીદાર દેશો વચ્ચે આદાન-પ્રદાન કરવામાં આવ્યું છે, અને સાથે રાષ્ટ્રિય પ્રયાસો પર ની માહિતીની આપ-લે કરવામાં આવી છે.

આ વાતચીતોથી એ નિષ્કર્ષ નિકળ્યો છે કે ઉભરી રહેલા પડકારો પર સાથીદાર દેશો વચ્ચે વાસ્તવિક-સમયનાં સંચાર અને બધા લોકો સલામત અને સુરક્ષિત ન રહે ત્યાં સુધી કોઈપણ એક સલામત અને સુરક્ષિત ન રહી શકે તે વાસ્તવિકતાનાં આધાર પર એકબીજાની શ્રેષ્ઠ પ્રયાઓમાંથી શિક્ષણ મેળવવાની જરૂર છે. તેઓએ સમકાલિન વાસ્તવિકતાઓ પ્રતિબિંબિત કરવા માટે વૈશ્વિકરણ અને આંતરરાષ્ટ્રિય સંસ્થાનોનાં નવા નમુનાની જરૂરીયાત પર ભાર મુક્યો હતો. સુરક્ષિત અને ટકાઉ અર્થતંત્રની રીકવરી અને રાષ્ટ્રિય અર્થતંત્રોમાં વૃદ્ધિ માટે મધ્યમ-ગાળાનાં આયોજન પર જોડાણ આગળ વધારવામાં; પારસ્પરિક પૂરવણીઓ પર મહત્વની પૂરવઠા સાંકળોનાં નિર્માણમાં સ્થિતિસ્થાપકતા અને નિર્થકતાઓ; અને રસીઓ અને ઉપચારોમાં ઝડપી વિકાસ અને પ્રસારમાં સંયુક્ત હિત સમાયેલું છે, જે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક પ્રાંત તરફ યોગદાન આપશે અને વ્યાપક રીતે સમગ્ર વિશ્વને લાભકારક બનશે.

નવી દિલ્હી

મે 14, 2020

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.